

Extra No. 9



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXV]

THURSDAY, JANUARY 25, 2024 / MAGHA 5, 1945

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

**Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Courts, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities under the Election Commission.**

ગુજરાત વિધુત નિયંત્રક આયોગ
ગાંધીનગર, ૨૪મી જાન્યુઆરી, ૨૦૨૪
૨૦૨૪ ના જાહેરનામા ક્રમાંક : ૦૩

તારીખ: ૬ ડિસેમ્બર, ૨૦૨૩ ના ગુજરાત રાજપત્ર (અસાધારણ) માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સન ૨૦૨૩ ના જાહેરનામા ક્રમાંક ૪ નો ગુજરાતી અનુવાદ આથી સર્વે લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

રણજીત કુમાર જે., આઈ.એ.એસ.
સચિવ.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (જીઈઆરસી) ગાંધીનગર
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (જામીન અનામત) (તૃતીય સુધારા) વિનિયમો, ૨૦૨૩
જાહેરનામું

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (જામીન અનામત) વિનિયમો, ૨૦૦૫ના ખંડ પ.૩ સાથે વાંચતા, ૨૦૦૩ના વિજળી અધિનિયમની કલમ ૪૭ અને કલમ ૧૮૧ (૨) (y) અને (w) હેઠળ મળેલી સત્તાની રૂએ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ આથી, જામીન અનામત વિનિયમો, ૨૦૦૫ (સન ૨૦૦૫ ના જાહેરનામા ક્રમાંક ૮) (મુખ્ય વિનિયમો)માં સુધારો કરે છે.

૧. ટૂંકુ શીર્ષક, વ્યાપ્તિનું ક્ષેત્ર અને આરંભ

- ૧.૧ આ વિનિયમો, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (જામીન અનામત) (તૃતીય સુધારા) વિનિયમો, ૨૦૨૩ કહેવાશે.
 ૧.૨ આ વિનિયમો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે.
 ૧.૩ આ વિનિયમો સરકારી રાજપત્રમાં તેની જાહેરનામાની તારીખથી અમલમાં આવશે.

૨. મુખ્ય વિનિયમોના પ્રકરણ ૨-માં સુધારો.

૧. મુખ્ય વિનિયમોના ખંડ ૨.૧ (ણ)ને, નીચે પ્રમાણે મૂકવો :

“કામચલાઉ સેવા” એટલે શરૂઆતમાં બાર મહિનાથી વધુ ન હોય તેવી મુદત માટે આપવામાં આવતો વીજળી પુરવઠો, જે કાયમી પુરવઠાના હેતુ માટે વીજ-ગોઠવણના વર્ગીકરણ અનુસાર વધુ મુદત લંબાવવા માટે સમીક્ષાને અધીન રહેશે.

૩. મુખ્ય વિનિયમોના પ્રકરણ ૪-માં સુધારો.

૧. મુખ્ય વિનિયમોના ખંડ ૪.૧૧ને, નીચે પ્રમાણે મૂકવો :

૪.૧૧ પરવાનેદાર, પૂરી પાડેલી વીજળી માટે કામચલાઉ ગ્રાહક પાસેથી મેળવેલ જામીન અનામત સિવાયની ગ્રાહકની જામીન અનામત પર, ભારતીય રિઝર્વ બેંકે નિર્દેષ કરેલા (દર વર્ષે ૧લી એપ્રિલ રોજ મુજબ) બેંક દરે અથવા આયોગ વખતોવખત નક્કી કરે તેવા ઊંચા દરે વ્યાજ ચૂકવશે. ગ્રાહકના ખાતે આગલા વર્ષ દરમિયાન જમા થયેલી વ્યાજની રકમનો, માસિક બિલ પદ્ધતિ હેઠળ આવરી લેવાયેલા ગ્રાહકો માટે દર વર્ષે મે (મહિના)ના વીજળી બિલોમાં અને દ્વિ માસિક બિલ પદ્ધતિ હેઠળ આવરી લેવાયા હોય તેવા ગ્રાહકો માટે મે(મહિના) અથવા જૂન (મહિના)ના વીજળી બિલોમાં હિસાબમેળ કરાશે.

૨. મુખ્ય વિનિયમોના ખંડ ૪.૧૪ને, નીચે પ્રમાણે મૂકવો :

૪.૧૪ પરવાનેદાર, બન્ને પક્ષકારમાંથી કોઈપણ સમજૂતી સમાપ્ત કરે, તો કોઈ લેણાં હોય તો તેનો હિસાબમેળ કર્યા પછી જામીન અનામત ૭ (સાત) દિવસની અંદર પરત કરશે.

ગાંધીનગર

તારીખ: ૦૫/૧૨/૨૦૨૩

રણજીથ કુમાર જે., આઈ.એ.એસ.

સચિવ.

